

Annual report of Examination system Automation including present status

2015-16 : The automation of Admission and Examination system was initiated from the year 2015 in a phased manner with Infinity Infoway Pvt.Ltd, Rajkot. Exam Department started working through ERP Software with enrollment and first semester examination of Shastri (B.A.) and Acharya (M.A.) programs were generated.

2016-17 : Admit cards and Grade sheets were generated through ERP Software for first year regular candidates of Shastri(B.A.), Acharya (M.A.) and PGDCA programs.


2017-18 : Shikashastri(B.ed) and Diplomas programs Enrollment and first year exam results were generated through ERP. Admit cards and Grade sheets for second and third years of Shastri(B.A., Acharya (M.A.)),PGDCA programs were also generated through ERP Software.

2018-19 : Internal Marks entry from collegeside was implemented and generated through ERP Software

2019-20 : Barcode system for all programs were generated through ERP Software

The following **Examination modules** in the present ERP are **now operational**

- Fee collection for examination and Admission (online Payment Gateway)
- Generation of Admit Cards
- Marks entry for internal and End semester Examinations
- Generation of Exam Schedule
- Generation of Tabulated Marks
- Generation of Result Sheets
- Generation of Grade Sheets
- Generation of Barcode


Controller of Examination
Shree Somnath Sanskrit University
Veraval, Gujarat.



SHREE SOMNATH SANSKRIT UNIVERSITY

Online Enrollment System

PRESENTED BY : INFINITY INFOWAY PVT. LTD

Opp. Saptarshi Process Pvt Ltd, Beside Somnath Auto Agency, Nr.
Rajkamal Petrol Pump, Gondal Rd, Rajkot, Gujarat 360004

Signature

Registrar

Shree Somnath Sanskrit University
Veraval, Dist. Gf. Somnath (Gujarat)

- **Shree Somnath Sanskrit University Profile:**

- The Sanskrit literature is one of the richest in the world and Sanskrit is accepted as the mother of all the languages. Recent studies have shown that it is most computers friendly. Sanskrit is more scientific and phonetic language. Today, the scientific literature in Sanskrit available to us is vast and varied, covering subjects as diverse as alchemy and mathematics and metallurgy, gemology and zoology, and many more. Sanskrit language, with an incomparable store of knowledge and Science carries with itself a legacy of Indian tradition, is at the genesis of our well-developed nation.

- **Infinity Infoway Pvt. Ltd. Company Profile:**

- I IPL is a Rajkot (India) based consortium of web and software development. Since 2004 I IPL is helping businesses do better with the digital solutions. In the last 12 years I IPL has built strong clientele base across the countries (portfolio) based on our commitment to deliver and deliver solutions that work in unique ways. This confidence has come about with sincere perseverance, constant up gradation of applied technology and incisive experience & project management capabilities built over the years.


Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)




SHREE SOMNATH SANSKRIT UNIVERISTY-ENROLLMENT PROCESS

- **First Open the University website www.sssu.in**



- **Click the log in button. That will display the following screen.**

Login Form

	College	▼
	Username	
	Password	
		Login


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist Gir Somnath (Gujarat)


- Select college and enter the username and password of the college.
- Once you are log in, the following screen will display.
-

Current Year


2015-2016 ▼

ENROLLMENT ▼

ACHARYA




SHASTRI




- The current year will be selected by default. Select the enrollment option. Then select Acharya or Shastri. The following screen will be displayed.


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)



➤ Click semester 1. The following screen about the details regarding the enrollment will be displayed.



Handwritten signature

- Now go step by step
- Step - 1(Enrollment Form)
 - The form for Acharya will open.

ACHARYA ACHARYA SEM-I 2015-2016 CHANGE SEMESTER / YEAR

STEP 1 → STEP 2 → STEP 3 → STEP 4 → STEP 5 → STEP 6 → STEP 7 → STEP 8

Enrollment Form Unenrollment Student Set Roll Number Lock Detail Download Report Enrolled Students I-Card Return

* ની નિશાની વાળા બધા ફિલ્ડ ફરજિયાત છે. બાકીના ફિલ્ડ ઓપ્શનલ છે.

COLLEGE DETAIL

College Code: 720 College Name: Test For Infinity

Course: ACHARYA Semester: ACHARYA SEM-I

1. Select Your Subject. (તમારા વિષય સિલેક્ટ કરો)

Compulsory Foundation (Please Select Any 1 Subject)

Compulsory Sanskrit

Core Compulsory (Please Select Any 1 Subject)

Ved

Sahitya

Puranetihas

Navy Vyakran

Navya Nyaya

Ramanuj Vedanta

Swaminarayana Vedanta (s)

Dharmashastra

Falit Jyotish

Swaminarayana Vedanta (j)

Vastushastra

Paurohityam

Sarvadarshana

Core Elective (Please Select Any 1 Subject)

Ved

Sahitya

Puranetihas

Dharmashastra

Prachin Rajnitishasra

Falit Jyotish

Sarvadarshana

Navy Vyakran

Discipline Centric Elective (Please Select Any 1 Subject)

Nibandh, Parisavand(seminar)

Paper:

CF411 - Compulsory Sanskrit

DCE411 - Nibandh, Parisavand(seminar)

2. Applicant's Name In Full(BLOCK LETTER):Mr./Ms./Mrs. (વિદ્યાર્થીનું નામ)

Last Name: _____ First Name: _____

Father Name: _____ Mother Name: _____

Shree Somnath

Registrar

Shree somnath Sanskrit University

Veraval,Dist Gir Somnath

➤ The form for Shastri will open like this.

ACHARYA ACHARYA SEM-1 2015-2016 CHANGE SEMESTER / YEAR

STEP 1 → STEP 2 → STEP 3 → STEP 4 → STEP 5 → STEP 6 → STEP 7 → STEP 8

Enrollment Form Unenrollment Student Set Roll Number Lock Detail Download Report Enrolled Students I-Card Remo

* ની નિશાની વાળા બધા ફિલ્ડ ફરજિયાત છે. બાકીના ફિલ્ડ ઓપ્શનલ છે.

COLLEGE DETAIL

College Code : 720 College Name: Test For Infinity
Course: ACHARYA Semester: ACHARYA SEM-I

1. Select Your Subject. (તમારા વિષય સિલેક્ટ કરો)

Compulsory Foundation (Please Select Any 1 Subject)
 Compulsory Sanskrit

Core Compulsory (Please Select Any 1 Subject)

- Ved
- Sahitya
- Puranetihas
- Navy Vyakran
- Navya Nyaya
- Ramanuj Vedanta
- Swaminarayana Vedanta (s)
- Dharmashastra
- Falit Jyotish
- Swaminarayana Vedanta (j)
- Vastushastra
- Paurohityam
- Saivadarshana

Core Elective (Please Select Any 1 Subject)

- Ved
- Sahitya
- Puranetihas
- Dharmashastra
- Prachin Rajnitishasra
- Falit Jyotish
- Sarvadarshana
- Navy Vyakran

Discipline Centric Elective (Please Select Any 1 Subject)
 Nibandh, Parisavand(seminar)

Paper:
CF411 - Compulsory Sanskrit
DCE411 - Nibandh, Parisavand(seminar)

2. Applicant's Name In Full(BLOCK LETTER):Mr./Ms./Mrs. (વિદ્યાર્થીનું નામ)

Last Name : _____ First Name : _____
Father Name: _____ Mother Name: _____

Surekha
Registrar

➤ The details are to be filled in the fields.

<u>Field</u>	<u>Details</u>
Subject Selection	Here you have to write the subject you select
Surname, first name, father's name, mother's name.	As per recorded in the mark sheet
Address for correspondence	Write your address and phone number
Birth date	As per the school leaving certificate
Nationality and gender	Write nationality and your gender
Category	Fill this field with your category, occupation and marital status. If you belong to sc/st/obc/ebc category and want to get the benefits of reservation, you will have to attach the caste certificate.
Details of HSC exams	A student will have to give the details as per the HSC mark sheet.
Other details	Here the student will have to provide the details of the name of the bank, branch name, code, name of the city, aadhar card number, ration card number etc.
List of attached documents	The list of the documents to be attached is to be given, and tick the box against it.
Photo and sign	The files of photo and the image of the sign of the students are to be uploaded. The size limit for each file should be 100 kb.

➤ After filling the details, click SAVE button.


/Registrar
Shree somnath Sanskrit University

- Step-2(unenrollment students)




- Here the names of all the students who have applied to be enrolled will be displayed. These details require the approval from the clerk and the principal. For that purpose, click the check button and then the button of the clerk. And in the same way, check button and the button of principal.
- Here the names of the students whose enrollment is approved will be displayed in the list given in ASSIGN option, and those who are not enrolled will be in the NO ASSIGN option.

 Report | | | | | | | | | | | | | --- | --- | --- | --- | --- | --- | --- | --- | --- | --- | | 2 | POPAT GUNJA JAMANBHAI | 102081 | | Report | | | | | | | 3 | FDFNFEDF FDSFSD SAFDF | 102081 | | Report | | | | | | | 4 | MONPARA C D | 1245 101081 | | Report | | | | | | At the bottom left of the table, there is a URL: 'http://www.sanskrituniversity.edu.in/Unenrolled_Students.aspx'."/> | | | |

- Here only those applications will be considered as valid who have got the approval from the clerk and the principal.


 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

➤ to get the report image, click 'report'. The image will be as below.

	શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ બેનરીસમેન્ટ ટેસ્ટ (સાસ્ત્રી-પ્રથમવર્ષ) (F.Y.B.A.) શિક્ષણિક વર્ષ:- 2015-2016	
પાસપોર્ટ સાઈઝ 720 પાસપોર્ટનું નામ Test For Infirity રજીસ્ટ્રેશન નંબર MONPARA G D B		
Surname	Name	Father/Husband Name
Mother's Name		
1. પસંદ કરેલ પત્રોના વિષયની માહિતી ટીપ્પણ છે. (Selected Paper/Subject Information) :		
Paper No	Paper Code	Subject Name
Paper 01		
Paper 02		
Paper 03		
Paper 04		
Paper 05		
Paper 06		
Paper 07		
Paper 08		
2. સંપર્કનું સ્થળ (Correspond Address) :		
સ્થળ (Address) :	Rajkot	
તાલુકો (Taluka) :	rajkot	મોબાઈલ નંબર (Mob. No.) : 9428893532
જિલ્લો (District) :	AHMEDABAD	રજીસ્ટ્રેશન નંબર (Res. No.) : 12345648
પિન્કોડ (Pin Code) :	123	ઈ-મેઈલ એડ્રેસ (E-mail) : rk.monparasa@gmail.com
3. વ્યક્તિની વ્યક્તિગત માહિતી (Personal Information) :		
જન્મ તારીખ (Date of Birth) :	16/08/1999	વિવાહિત માહિતી (Marital Status) : Unmarried
રાષ્ટ્રિયતા (Nationality) :	Indian	ધર્મ (Religion) : hindu
લિંગ (Gender) :	Male	રક્ત જૂથ (Blood Group) : B+
શ્રેણી (Category) :	Open	રહેણાંક વિસ્તાર (Resident Area) : Village
સબ-શ્રેણી (Sub-Category) :		વાર્ષિક વાર્ષિક આવક (Family Annual Income) : 20000
વ્યવસાય (Occupation) :	Government Job	


Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

5 અન્ય માહિતી (Other Details)

બેંક ખાતાનો નંબર (Bank A/c No.):	_____	આધારકાર્ડ નંબર (Aadhar Card No.):	_____
બેંક નું નામ (Bank Name):	_____	રેશનકાર્ડ વિગત (Ration Card Details):	BPL
બેંક શાખા કોડ (Bank Branch Code):	_____	રેશનકાર્ડ નંબર (Ration Card No.):	_____
બેંક શાખા સીટી નું નામ (Bank Branch City Name):	_____		

6 કોઈ અન્ય દસ્તાવેજો અને સંબંધિત વિગત (attested document detail):

(1) Nss Certificate

ઉપરોક્ત માહિતી સંપૂર્ણપણે સાચી તથા સત્ય છે. **MONPARA G D**
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ અધિકારીઓ/શિક્ષકો/અધ્યાપકો દ્વારા પ્રવેશકાળ અને અભ્યાસકાળમાં અભ્યાસ કરવાની બંધનતા હેઠળ શિક્ષકો અને શિક્ષકો
નિયમોનું પાલન કરવાની જવાબદારી સારું છે.

તારીખ _____



(વિદ્યાર્થીની સહી)

:: (અભ્યાસકાળ/સેનેટના પુસ્તકાલોકની/આધારકાર્ડની સત્યાપી વિગત)::

આમી હું પ્રમાણિત છું છું _____ વિદ્યાર્થીને એન્ટ્રન્સ-૧૨/અભ્યાસ
કે તેનો અભ્યાસ પરીક્ષામાં બેઠામાં _____ થી પરીક્ષા પાસ કરે છે, અને તેને આ પરીક્ષામાં સુલભતા તેમજ પરિણામ
પાસ કરવામાં સંબંધિત અભ્યાસ કરવા વિગતો સારની અભ્યાસકાળમાં પ્રવેશને પાસ છે. આમ વિદ્યાર્થીને આ નિયમ હી અભ્યાસ આપેલ છે.

તારીખ _____

:: સુચનાઓ ::

- ૦૧ એન્ટ્રન્સમેન્ટ ફી જેટલું રૂ. ૧૦૦/- વિદ્યાર્થીને ભરવાના રહેશે.
- ૦૨ અધિકૃત વીજાવલોક તથા ડોક્યુમેન્ટ અપૂર્ણ જોડવામાં આવેલ કોષ તે કોર્મ રદ થશે. ડોક્યુમેન્ટની જરૂરીયાત સ્વ-પ્રમાણિત જોડવી.
- ૦૩ પ્રવેશકાળે અધિકારીઓના પ્રધાનાધ્યક્ષ/આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવેલ શરતો અનુસાર આલેખ છે. કોઈપણ સંજોગોમાં સીધા આવેલ પ્રવેશકાળે સ્વીકારવામાં આવશે નહીં અને પ્રવેશ અંગેના સીધા પત્રો અધિકારી દ્વારા પ્રવેશકાળે આપવામાં આવશે.
- ૦૪ જે વિદ્યાર્થી ઓની જરૂરી દસ્તાવેજો ન મેળવવાને કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અપાસ કર્યા કોષ / જરૂરી વિષય કે વિષયોમાં કોર્મમાં થયા ન કોષ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા અંગેના નિયમો સાચા-સત્ય: હાલ પડતા ન કોષ તેવા વિદ્યાર્થીના પ્રવેશકોર્મ રદ થશે.
- ૦૫ યુનિવર્સિટીના નિયમાનુસાર શિક્ષકો દ્વારા અભ્યાસકાળ પૂર્ણ કરવાનો અનુભવ સમયગાળો ૩+૧(૫ વર્ષ) નક્કી થયેલ છે. આલેખ ૧૦ વર્ષ એન્ટ્રન્સમેન્ટ થવાર વિદ્યાર્થીઓને એ-૨૦૨૧ સુધીમાં શિક્ષકો દ્વારા અભ્યાસકાળ પૂર્ણ કરી લેવાનો રહેશે. એ એ-૨૦૨૧ સુધીમાં શિક્ષકો દ્વારા અભ્યાસકાળ પૂર્ણ કરી નહીં તો તેમને પુનઃ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

:: યુનિવર્સિટી અધિકારીઓ દ્વારા ::

એન્ટ્રન્સમેન્ટ નંબર: _____

Checked By:

Verified By:

Date:

Signature

- Step- 3(Set Roll Number)

➤ Here you can set the roll numbers of the students. It is not compulsory.

Here you will find the list of the assigned students. Write their roll number in the box against the names and save.

ACHARYA ACHARYA SEM-1 2015-2016 CHANGE SEMESTER / YEAR

step 1 → step 2 → **step 3** → step 4 → step 5 → step 6 → step 7 → step 8

Enrollment Form Unenrollment Student Set Roll Number Lock Detail Download Report Enrolled Students T-Card Remark

Set Student Roll No.

અહી તમારે વિદ્યાર્થી ના Roll Number સેટ કરવાના રહેશે. Roll Number સેટ કરવા માટે વિદ્યાર્થી ના નામ સામે આપેલા બોક્સ માં વિદ્યાર્થી ના Roll Number નાખી નીચે આપેલા Save નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. તેમજ Roll Number પેજ વાઈઝ Save કરવલ.

Student Name Search

Serial No.	Student Name	Set Roll No.
1	APATELL SAGAR A	<input type="text"/>
2	B B B	7888
3	FADADU M C	4588
4	A T A	<input type="text"/>

Evelina
Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist Gir Somnath (Gujarat)

• Step- 4(Lock detail)

- After completing the enrollment process, you can lock all the details.
- Check the number of the assigned and non assigned students and click on the Lock Degree. You will not be able to make changes in the details now.

ACHARYA	ACHARYA SEM-1	2015-2016	CHANGE SEMESTER / YEAR				
STEP 1	STEP 2	STEP 3	STEP 4	STEP 5	STEP 6	STEP 7	STEP 8
Enrollment Form	Unenrollment Student	Set Roll Number	Lock Detail	Download Report	Enrolled Students	I-Card	Remark
Lock Enrollment							
<p>Enrollment ની બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અહી તમારે Degree Lock કરવાની રહેશે , lock કર્ય બાદ તમે Enrollment ના ફોર્મ ભરી શકશો નહિ તેમજ ફોર્મ માં કોઈ સુધારો કરી શકશો નહિ એથી બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ lock કરવું.</p>							
Total Assign Student :- 21							
Total Not Assign Student :- 0							
Lock ACHARYA							


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

• Step- 5(Download Report)

- Here you can print the reports. You can print all types of reports by clicking on the print buttons.
- You can print 'all reports'. You have to submit it to the university along with a forwarding letter.

Print All Report	You can print all the reports by this button.
Forwarding Letter	This will print the list of the students with combination codes. Submit it to the University.
Print With Photo Signature	You can get the print with the photo and sign of the student.
Print All Student List	Here you will get the print of all the students.
As per Student Name	The list will be as per the names.
As per Roll Number	The list will be as per the numbers.
As per Combination	The list will be as per the combination codes.
As per Entry	The list will be as per the serial number of entry.
Print Challan	It will print a challan for the students.

E. S. Mehta
Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)



Enrollment Form Unenrollment Student Set Roll Number Lock Detail Download Report Enrolled Students I-Card Remark

Download Report

નીચે આપેલ રીપોર્ટ તમારે યુનીવર્સિટી માં જમા કરવાના રહેશે.

- (1) FORWARDING LETTER નામના બટન પર ક્લિક કરવાથી તમને એક લેટર મળશે.
- (2) PRINT ALL REPORTS નામના બટન પર ક્લિક કરવાથી બધા વિદ્યાર્થી નો ડિટેઇલ રીપોર્ટ નીકળશે.

Print All Report Forwarding Letter Download Enrollment Data Print Remark Detail Report

નીચે આપેલી વસ્તુઓ તમારે યુનીવર્સિટીમાં જમા કરાવા ની નથી, જે ફક્ત તમારી સમવહતા માટે છે.

- 1. PRINT ALL STUDENT LIST
- 2. AS PER STUDENT NAME
- 3. AS PER ROLL NUMBER
- 4. AS PER COMBINATION

Print with Photo Signature Export To Excel Data

Print All Student List As Per Student Name As Per Roll Number As Per Combination As Per Entry

Signature
Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-6(Enrolled Students)

- The enrollment numbers are given by the university for all the assigned students.

The enrollment number of the students can be seen by clicking the button.

Enrollment Form

ACHARYA ACHARYA SEM-1 2015-2016 CHANGE SEMESTER / YEAR

STEP 1 → STEP 2 → STEP 3 → STEP 4 → STEP 5 → **STEP 6** → STEP 7 → STEP 8

Enrollment Form Unenrollment Student Set Roll Number Lock Detail Download Report **Enrolled Students** I-Card Rema

Enrolled Students

Enrollment Number Report

Serial No	Student Name	Enrollment No	Combination Code	Birth Date	HSC Roll No	Seat No	Subject	View
1	SAGAR A APATELL	15632478	101021	12/11/1990			COMPULSORY SANSKRIT / VED / SAHITYA / NIBANDH, PARISAVAND(SEMINAR)	
2	GUNJA JAMANBHAI POPAT	156324789	102081	25/12/1992			COMPULSORY SANSKRIT / SAHITYA / DHARMASHASTRA / NIBANDH, PARISAVAND(SEMINAR)	
3	FDSFSD SAFDF FDFNFEFDF	1563289	102081	12/10/1989			COMPULSORY SANSKRIT / SAHITYA / DHARMASHASTRA / NIBANDH, PARISAVAND(SEMINAR)	

http://www.college-updates.com/Enrolled_Students.asp

E. S. Meena
 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-7(I-Card)

➤ Once the students are enrolled, you can print I-Cards here.

ACHARYA														
ACHARYA SEM-I		2015-2016		CHANGE SEMESTER / YEAR										
STEP 1	→	STEP 2	→	STEP 3	→	STEP 4	→	STEP 5	→	STEP 6	→	STEP 7	→	STEP 8
Enrollment Form		Unenrollment Student		Set Roll Number		Lock Detail		Download Report		Enrolled Students		I-Card		Remark
Student Icard														
તમારે નીચે આપેલા ફોરમેટને PDF માં Download કરી લેવાનું છે જેમાં ઉલ્લેખ પેકજ Icardનો પાછળનો ભાગ આપેલો છે														
જે બધા Icard પાછળ Print કરી શકે છે														
http://sssu.in/college-spi/Form_Student_icard.aspx														


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

Feedback

Date : / / 2016

Name of college : _____

How did you find today's demonstration?

Do you need more information?

YES NO

Write you opinion.

Thanks

Infinity Infoway Pvt. Ltd.


Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)



SHREE SOMNATH SANSKRIT UNIVERSITY

Online Enrollment System

Academic YEAR 2016-17

PRESENTED BY : INFINITY INFOWAY PVT. LTD

Opp. Saptarshi Process Pvt Ltd, Beside Somnath Auto Agency, Nr.
Rajkamal Petrol Pump, Gondal Rd, Rajkot, Gujarat 360004


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

• **Shree Somnath Sanskrit University Profile**

- Shree Somnath Sanskrit University, Veraval was established by Government of Gujarat through an Act of Legislative Assembly passed on April 1, 2005. University Grants Commission gave approval under section 2 (f) and included it in the list of recognized Universities on February 17, 2006. Academic Sessions of College began from June 2006 and Post Graduate Sahitya Department was established on July 20, 2006. It is the Public State University with Sanskrit as its medium of instruction, having 7 Faculties, 1 Constituent College, wherein more than 275 students on campus are pursuing higher studies under the care and supervision of 21 teaching (16 Permanent) and 30 (19 Permanent) supporting staff members. More than 4472 students are registered in the University affiliated Colleges/Institutes/Centers in the academic year 2015-16. Till date, University has given academic affiliation to 36 Colleges/Institutions including University Sanskrit College and one B.Ed. College across Gujarat. At present, 40 Diploma Centers and 37 P.G.D.C.A. Study Centers are functioning. Further, University has given approval to the world famous 'ARSH' Akshardham Research Institute for Social Harmony, Gandhinagar and Ta0vajnan Mandir Research Institute, Modasa as Research Institutes. It is the only special Sanskrit University of Gujarat as it offers a wide range of courses in Sāhitya, Jyotiṣhaśāstra, Vāstuśāstra, Veda, Vyākaraṇa, Navya Vyākaraṇa, Rāmānuja Vedānta, Swāminārāyaṇa Vedānta, Sarva Darśana, Navya Nyāya, Dharmaśāstra, Purāṇaśāstra, Paurohityam and Yoga. It gives opportunity for education starting from Certificate Course to Ph.D. In addition to this, English, Computer Applications, Gujarat, Hindi and Sociology are also offered at affiliated Colleges across Gujarat. University conducts its academic programmes under C.B.C.S. (Choice Based Credit System) and Semester System from the academic year 2011-12.
- Śāradā Bhavana, the University Library contains around 7,000 volumes. Pujya Shri Morari Bapu has made a generous donation of rupees 3 lacs for procuring reference books in Sanskrit and he has inaugurated it on October 17, 2013. It was named as 'Triveni Reference Library' in the pious memory of Shri K.K. Shastri, Pujya Dongare Maharaj and Pujya Virag Muni. It gives the facility of reading room, issue & return, reference and referral services book bank, old question papers, selling of University publications as well as University Granth Nirman Board publications etc. at its outset. Efforts have been made to keep sufficient number of textbooks for students and basic reference books for the faculty and scholars. University has state of art Computer Lab with more than 25 PCs. All the departments are accessible through Intercom facility. University is ICT enabled.

• **Infinity Infoway Pvt. Ltd. Company Profile:**


- IIPL is a Rajkot (India) based consortium of web and software development. Since 2004 IIPL is helping businesses do better with the digital solutions. In the last 12 years IIPL has built strong clientele base across the countries (portfolio) based on our commitment to deliver and deliver solutions that work in unique ways. This confidence has come about with sincere perseverance, constant up gradation of applied technology and incisive experience & project management capabilities built over the years.


Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

SHREE SOMNATH SANSKRIT UNIVERISTY - ENROLLMENT PROCESS

- First Open the University website www.sssu.in



- Click the log in button. That will display the following screen.

Login Form

Login


- Select college and enter the username and password of the college.
- Once you are log in, the following screen will display.

Surekha
/Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)


Current Year

2016-2017

ENROLLMENT



- The current year will be selected by default. Select the enrollment option. Then select PGDCA The following screen will be displayed.



Click semester 1. The following screen about the details regarding the enrollment will be displayed.

Home Enrollment Change Password

POST GRADUATE DIPLOMA IN COMPUTER SCIENCE AND APPLICATION PGDCA SEM-1 2016-2017 CHANGE SEMESTER / YEAR

1 Enrollment Form → 2 Unenrollment Student → 3 Set Roll Number → 4 Lock Detail → 5 Download Report → 6 Enrolled Students → 7 I-Card

Enrollment કરતા પહેલા નીચેની માહિતી વાચી લેવી


શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
પી.ઠી.સી.એ. એનરોલમેન્ટ-૨/પ્રવેશના નિયમો
શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૬

૦૧. પીઠવીસીએમાં પ્રવેશ પાડે અભ્યાસ કે તેની અપાસ કામને જખર અનરક કોમ્પટી તવા પ્રવલ (B.C., B.T., B.E.B.C.) માટે સોના જરૂરી છે, જે વિદ્યાર્થીઓને આરક્ષકની આલ લેવાનો સીમ તેમને જાતિ અભિનુ પ્રખાલખન સહમ સંબધિત અ/વિદ્યાર્થીની પ્રખાલિત નામ અધિકેલ સહી તપરે જ માન્ય રહેશે.

૦૨. પ્રવેશ અભેલી સહુતમ સમખપાઓ ૧ વર્ષની રહેશે તેજા પહાતમ સમખપાઓ ૨ વર્ષની રહેશે.(૧ વર્ષ રમુલાર તવા ૧ વર્ષ રીપીટર છે) અનયા તેમનુ વહાલોલન ૨૬ થશે.

Registrar
Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist.Gir Somnath (Gujarat)

- Now go step by step
- Step-1 Enrollment Form
- The form for PGDCA will open



* ની નિશાની વાળા બધા ફિલ્ડ ફરજિયાત છે. બાકીના ફિલ્ડ ઓપ્શનલ છે.

COLLEGE DETAIL			
College Code :	<input type="text" value="720"/>	College Name:	<input type="text" value="Test For Infinity"/>
Course:	<input type="text" value="Post Graduate Diploma in Computer ;"/>	Semester:	<input type="text" value="PGDCA SEM-I"/>

1. Select Your Subject. (તમારા વિષય સિલેક્ટ કરો)

Core Compulsory (Please Select Any 6 Subject)	Paper
<input checked="" type="checkbox"/> Computer Fundamentals, Networking & HTML	101 - Computer Fundamentals, Networking & HTML
<input checked="" type="checkbox"/> Logic Development using Programming Language C	102 - Logic Development using Programming Language C
<input checked="" type="checkbox"/> GUI Programming using VB	103 - GUI Programming using VB
<input checked="" type="checkbox"/> PC Packages	104 - PC Packages
<input checked="" type="checkbox"/> Compulsory Sanskrit	105 - Compulsory Sanskrit
<input checked="" type="checkbox"/> Practical	106 - Practical

2. Applicant's Name In Full(BLOCK LETTER):Mr./Ms./Mrs. (વિદ્યાર્થીનું નામ)


 Registrar
Shree somnath Sanskrit University
 Veraval,Dist.Gir Somnath (Gujarat)

- The details are to be filled in the fields.

<u>Field</u>	<u>Details</u>
Subject Selection	Here you have to write the subject you select
Surname, first name, father's name, mother's name.	As per recorded in the mark sheet
Address for correspondence	Write your address and phone number
Birth date	As per the school leaving certificate
Nationality and gender	Write nationality and your gender
Category	Fill this field with your category, occupation and marital status. If you belong to sc/st/obc/ebc category and want to get the benefits of reservation, you will have to attach the caste certificate.
Details of HSC exams	A student will have to give the details as per the HSC mark sheet.
Other details	Here the student will have to provide the details of the name of the bank, branch name, code, name of the city, aadhar card number, ration card number etc.
List of attached documents	The list of the documents to be attached is to be given, and tick the box against it.
Photo and sign	The files of photo and the image of the sign of the students are to be uploaded. The size limit for each file should be 100 kb.

- After filling the details, click SAVE button.


 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-2(unenrollment students)

- Here the names of all the students who have applied to be enrolled will be displayed. These details require the approval from the clerk and the principal. For that purpose, click the check button and then the button of the clerk. And in the same way, check button and the button of principal.
- Here the names of the students whose enrollment is approved will be displayed in the list given in ASSIGN option, and those who are not enrolled will be in the NO ASSIGN option.

Unenrolled Students.

Select Assign Status :

Student Name Search

Click on student name header to sort student by alphabet

Order By : Student Name Roll No Combination Code As Per Entry

No	Name	Roll	Code	Clerk Approve	Principal Approve	Update	Report	Delete	View
1	APATELL SAGAR A	101021		<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		Report	X	
2	POPAT GUNJA JAMANBHAI	102081		<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		Report	X	
3	FDFNFEFDF FDSFSD SAFDF	102081		<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		Report	X	
4	MONPARA C D	1245 101081		<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>		Report	X	

- Here only those applications will be considered as valid who have got the approval from the clerk and the principal.
- To get the report image, click 'report'. The image will be as below.

Evelina
 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)



શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
બેચેલર ઓફ આર્ટ્સ (સામાન્ય-પ્રથમવર્ષ) (F.Y.B.A.)
શિક્ષણ વર્ષ:- 2016-2018



પ્રવેશિકા કોર્સ 720

પ્રવેશિકાનું નામ Test For Infirity

કોર્સનું નામ: MONPARA G D B
 Surname Name Father/Husband Name Mother's Name

1. પસંદ કરેલાં પાઠ્યક્રમ વિષયની પાઠ્યક્રમ વિગતો (Selected Paper/Subject Information) :

Paper No	Paper Code	Subject Name
Paper 01		
Paper 02		
Paper 03		
Paper 04		
Paper 05		
Paper 06		
Paper 07		
Paper 08		

2. અનુબંધી સંબંધી (Correspond Address) :

સરનામું (Address) : Rajkot
 તાલુકો (Taluka) : rajkot મોબાઈલ નંબર (Mob. No.) : 9428893532
 જિલ્લો (District) : AMMEDABAD ઘરના નંબર (Res. No.) : 12345646
 પીન્કોડ (Pin Code) : 123 ઈ-મેઈલ એડ્રેસ (E-Mail) : rk.morparass@gmail.com

3. વ્યક્તિકી વિગતો (Personal Information) :

જન્મ તારીખ (Date of Birth) : 16/08/1999 વિવાહિત સ્થિતિ (Marital Status) : Unmarried
 રાષ્ટ્રિયતા (Nationality) : Indian ધર્મ (Religion) : Hindu
 લિંગ (Gender) : Male રક્ત સમૂહ (Blood Group) : B+
 શ્રેણી (Category) : Open રહેણાંક વિસ્તાર (Resident Area) : Village
 સબ-શ્રેણી (Sub-Category) : _____ કુટુંબી વાર્ષિક આવક (Family Annual Income) : 20000
 વ્યવસાય (Occupation) : Government Job

(Signature)
 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

5 અન્ય વિગતો (Other Details)

બેંક ખાતાનો નંબર (Bank A/c No):	_____	અધિકારક નંબર (Authorised No.):	_____
બેંક નું નામ (Bank Name):	_____	રેશનકાર વિગત (Rationcard Details):	BPL
બેંક શાખા કોડ (Bank Branch Code):	_____	રેશનકાર નંબર (Rationcard No.):	_____
બેંક શાખા સીટી નું નામ (Bank Branch City Name):	_____		

6 કોર્સ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટની વિગત (attested document detail):

(1) Non Certificate

કોર્સના માહિતી અંગ્રહણને સચવી તથા સત્ય છે. ન MONPARA G D
 શ્રી મોનપરા ગ્રામીણ યુનિવર્સિટી તેમજ અધિકારક/કોર્સ/અભ્યાસ કરાવનાર અને અધિકારકમાં અમલી બનાવવા પાસા પોસ્ટથી અને કિસ્મતના
 વિષયોનું મુદતપણે પાસા કરવાની આગેમી આપું છું.

તારીખ _____



(વિધવાર્થીની સહી)

:(અધિકારક/કોર્સના પુનરાવર્તન/અધિકારકની સરવાળી વિગત)::

આથી હું પ્રમાણિત છું છું _____ વિધવાર્થીને કોર્સ-૧૨/અભ્યાસ
 કે તેની સમગ્ર પરીક્ષામાં બેઠામાં _____ થી પરીક્ષા પાસ કૃત છે, અને તેને આ પરીક્ષામાં મુદતપણે તેમજ પરિણામ
 પાસ પ્રવેશમાં અંતર્ગતમાં મહત્વના સહ વિધવાર્થી યાદગી અભ્યાસક્રમમાં પ્રવેશને પાસ છે. આ વિધવાર્થી કોર્સ વિષયની સરવાળા આલેખ છે.

તારીખ _____

:(સુચનાઓ):

- ૦૧ એનરોલમેન્ટ ફી જેટલે રૂ. ૧૦૦/- વિધવાર્થીને ભરવાના રહેશે.
- ૦૨ અધુરી વીમતવાળા તથા ડોક્યુમેન્ટ અપૂર્ણ બોડવામાં આવેલ હોય તે કોર્સ રદ થશે. ડોક્યુમેન્ટની જરૂરી સવ-પ્રમાણિત બોડવી.
- ૦૩ પ્રવેશપત્રો મહાવિધ્યાલયના પ્રધાનાચાર્ય/આચાર્ય માર્ગદર્શ લઈને મોકલવા આવશ્યક છે. કોર્સપાઠ અંગેઓમાં સીધા આવેલ પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહીં અને પ્રવેશ અંગેના સીધા પ્રત્યક્ષવાર પ્રત્યેકમાલ આપવામાં આવશે.
- ૦૪ જે વિધવાર્થી ઓની જરૂરી દસ્તાવેજી ન બેઠાવવાને કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા ક્યાં હોય / જરૂરી વિષય કે વિષયોમાં કોર્સમાં થયા ન હોય અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ બેઠાવવા અંગેના નિયમો સામન્યતા: સામાન્યતા ન હોય તેવા વિધવાર્થીના પ્રવેશકોર્સ રદ થશે.
- ૦૫ યુનિવર્સિટીના નિયમાનુસાર યાદગી કક્ષામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો મહત્તમ સમયગાળો ૩+૨(૫ વર્ષ) નક્કી થયેલ છે. આથી ઇતિહાસિક વર્ષ એનરોલમેન્ટ થનાર વિધવાર્થીઓએ યે-૨૦૨૧ સુધીમાં યાદગીનો અભ્યાસક્રમ પૂર્ણ કરી લેવાનો રહેશે. યે-૨૦૨૧ સુધીમાં યાદગીનો અભ્યાસક્રમ પૂર્ણ કરશે નહીં તો તેમને પુન: રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

:(યુનિવર્સિટી અધિકારક પાસે):

એનરોલમેન્ટ નંબર: _____

Checked By: _____

Date: _____


Verified By: _____

(Handwritten Signature)

Step- 3 (Set Roll Number)

- Here you can set the roll numbers of the students. It is not compulsory.

Here you will find the list of the assigned students. Write their roll number in the box against the names and save.



અહી તમારે વિદ્યાર્થી ના Roll Number સેટ કરવાના રહેશે. Roll Number સેટ કરવા માટે વિદ્યાર્થી ના નામ સામે આપેલા બોક્ષ માં વિદ્યાર્થી ના Roll Number નાખી નીચે આપેલા Save નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. તેમજ Roll Number પેજ વાઇઝ Save કરવા.

Student Name Search

Serial No.	Student Name	Set RollNo.
1	APATELL SAGAR A	<input type="text"/>
2	B B B	7888

Step- 4(Lock detail)

- After completing the enrollment process, you can lock all the details.
- Check the number of the assigned and non assigned students and click on the Lock Degree. You will not be able to make changes in the details now.



Enrollment ની બધી પ્રક્રિયા પૂર્ણ થાય બાદ અહી તમારે Degree Lock કરવાની રહેશે , lock કર્ય બાદ તમે Enrollment ના ફોર્મ ભરી શકશો નહિ તેમજ ફોર્મ માં કોઈ સુધારો કરી શકશો નહિ એથી બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ lock કરવું.

Total Assign Student :- 21
Total Not Assign Student :- 0


Lock ACHARYA


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

• Step- 5(Download Report)

- Here you can print the reports. You can print all types of reports by clicking on the print buttons.
- You can print 'all reports'. You have to submit it to the university along with a forwarding letter.

Forwarding Letter	This will print the list of the students with combination codes. Submit it to the University.
Print With Photo Signature	You can get the print with the photo and sign of the student.
Print All Student List	Here you will get the print of all the students.
As per subject	The list will be as per the subject.
Print Challan	It will print a challan for the students.



Download Report

नीचे आपेल रीपोर्ट तमारे युनीवर्सिटी मा जमा करवाना रहेसे.

- (1) PRINT ALL STUDENT REPORTS नामना बटन पर क्लिक करवायी बधा विद्यार्थी नो डिटेल रीपोर्ट नीकणसे.
- (2) FORWARDING LETTER नामना बटन पर क्लिक करवायी तमने अेक लेटर मणसे.
- (3) SUBJECT WISE REPORTS नामना बटन पर क्लिक करवायी बधा विद्यार्थी ना विषय नी माहिती नो डिटेल रीपोर्ट नीकणसे.
- (4) CHALLAN नामना बटन पर क्लिक करवायी बेन्क मा सरवाना यलए नो रिपोर्ट नीकणसे.

Print All Student Report

Forwarding Letter

Subject Wise Report

challan

नीचे आपेली वरतुओ तमारे युनीवर्सिटीमा जमा करवा नी नधी, अे कसत तमारी सगवस्ता अडे छे.

1. PRINT WITH PHOTO SIGNATURE
2. EXPORT TO EXCEL DATA

Print with Photo Signature

Export To Excel Data

(Signature)

/Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-6(Enrolled Students)

- The enrollment numbers are given by the university for all the assigned students.

The enrollment number of the students can be seen by clicking the button.

Enrolled Students

Enrollment Number Report

Serial No	Student Name	Enrollment No	Combination Code	Birth Date	HSC Roll No	Seat No	Subject	View
1	SAGAR A APATELL	15632478	101021	12/11/1990			COMPULSORY SANSKRIT / VED / SAHITYA / NIBANDH, PARISAVAND(SEMINAR)	
2	GUNJA JAMANBHAI POPAT	156324789	102081	25/12/1992			COMPULSORY SANSKRIT / SAHITYA / DHARMASHASTRA / NIBANDH, PARISAVAND(SEMINAR)	

- Step-7(I-Card)

Once the students are enrolled, you can print I-Cards here.

Student Icard

તમારે નીચે આપેલા ક્લિકમેટને PDF માં Download કરી લેવાનું છે જેમાં છેલ્લું પેઠઝ Icardનો પાછળનો ભાગ આપેલો છે જે બધા Icard પાછળ Print કરી શકો છો

http://www.incollege-epiForm_Student_icard.asp/

Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

Feedback

Date : / / 2016

Name of college : _____

How did you find today's demonstration?

Do you need more information?

YES

NO

Write you opinion.

Thanks

Infinity Infoway Pvt. Ltd.


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)



Online Internal Marks Entry Process

USER MANUAL

(with effect from DEC-2018 Exam)

[Handwritten Signature]

Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

Follow the following procedure to enter the internal marks of the semester exams of Shastri ans Acharya

- Open the browser and open the site www.sssu.in .

The following window will open. Enter the username and the password of the college/Mahavidyalaya.



The confidentiality of the username and password is to be maintained by the principal. In case of missing, contact the controller of the examination or email him on sssu.exam@gmail.com





After log in, the following window will open. Select the current year. E.g. (2018-2019). Select EXAM from EXAM and ENROLLMENT.

- Click on Shastri or Acharya for the regular students, new syllabus. Click on Shastri old for the old course students.

Handwritten signature

Registrar

Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

<p>पूनी अध्यासक्रम (वर्ष , २०१३-२०१४ची अपरतम आवेळ नवी अध्यासक्रम) हादामा शास्त्रीकक्षांना सेमेस्टर-५ शी ६ माटे</p>	<p>Select Year</p> <p>2019-2018</p> <p>ENROLLMENT</p> <p>ENROLLMENT</p> <p>EXAM</p>	<p>नवी अध्यासक्रम (वर्ष , २०१३-२०१४ची अपरतम आवेळ नवी अध्यासक्रम) हादामा शास्त्रीकक्षांना सेमेस्टर-१ शी ४ माटे</p>
<p>SHASTRI OLD</p> 	<p>ACHARYA OLD</p> 	<p>SHASTRI</p> 
	<p>ACHARYA</p> 	<p>नवी अध्यासक्रम (वर्ष , २०१३-२०१४ची अपरतम आवेळ नवी अध्यासक्रम) हादामा आचार्यकक्षांना सेमेस्टर-१ शी ४ माटे</p>


- The data entry of the internal marks for Shastri and Acharya is to be done by the college/Mahavidyalaya. Select Shastri or Acharya whichever you want to enter first.
- When you select any level of Shastri or Acharya, finish the procedure from Report to Lock. Then log out and start the entry for another level. Do not enter the marks of two levels simultaneously.
- After the above said step, select Exam and select Level. The following window will open. For the entry of first semester of Shastri and Acharya, click on 'Enrollment to semester 1', for the data entry of semester 3, click on 'semester 2 to 3', for the data entry of semester 5 of Shastri, click on 'semester 4 to 5'


 Registrar
 Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

સેમેસ્ટર - 01ની ડેટા
એન્ટ્રી માટે અહીં ક્લિક
કરવાનું રહેશે.

સેમેસ્ટર - 03ની ડેટા
એન્ટ્રી માટે અહીં ક્લિક **Close**
કરવાનું રહેશે.

Welcome To Exam Process



- For the entry of first semester of Shastri and Acharya, click on 'Enrollment to semester 1', for the data entry of semester 3, click on 'semester 2 to 3', for the data entry of semester 5 of Shastri, click on 'semester 4 to 5'.

Following window will be opened after you select semester.

The screenshot shows the 'SHASTRI SEM-1' exam process window. The navigation menu includes: Home, Exam, Student, **Internal**, Repeater, Teacher Information, Assignment, and Export Student Details. The main content area displays a progress bar with steps 0 through 9. Step 0 is 'Add Group', which is currently selected. Below the progress bar, the text reads: 'Add Group/Manage Group'. A note in Gujarati states: 'અહીં તમે SHASTRI SEM-1 ના ગ્રુપ નું બીસ્ટ જોઈ શકશો. અહીંથી તમે તમારી કોલેજ માં SHASTRI SEM-1 માં ગ્રુપ Add કરી શકશો ગ્રુપ Add કરવા માટે તમારી કોલેજ માં જે ગ્રુપ યાલતું હોય તે ગ્રુપ ની સામે આપેલા Check Box પર ક્લિક કરી Submit નામના બટન પર ક્લિક કરવું. નોંધ :- ગ્રુપ પેજ વાઈઝ સેવ કરવા.'

Eshwar
Registrar

- Step-2. Click on 'Internal Download Data' and the following window will open. Select seat no. in the drop menu of Order By and click download to get the sheet of marks of all the students in excel. This is for the verification purpose for the college/Mahavidyalaya.

[Home](#) [Exam](#) [Student](#) [Internal](#) [Repeater](#) [Teacher Information](#) [Assignment](#)
[Export Student Details](#)

SHASTRI **SHASTRI SEM-1** **2016-2017** [CHANGE SEMESTER / YEAR](#)

STEP 1 → **STEP 2** → **STEP 3** → **STEP 4** → **STEP 5**
 Internal Marks Entry Internal Download Data Internal Testing Report Lock Internal Exam Final Internal Report

Internal Excel Download

Order By:

- Step-3. Click on 'Internal Testing Report' and following window will open. Click on 'Download Testing Report'. This report is for verification for the college and Mahavidyalaya, and not to submit to the University.

[Home](#) [Exam](#) [Student](#) [Internal](#) [Repeater](#) [Teacher Information](#) [Assignment](#)
[Export Student Details](#)

SHASTRI **SHASTRI SEM-1** **2016-2017** [CHANGE SEMESTER / YEAR](#)

STEP 1 → **STEP 2** → **STEP 3** → **STEP 4** → **STEP 5**
 Internal Marks Entry Internal Download Data Internal Testing Report Lock Internal Exam Final Internal Report

Internal Marks Testing Report

નીચે આપેલા **Download Testing Report** નામના બટન પરથી તમે રીપોર્ટ કાઢી શકશો આ રીપોર્ટ યુનીવર્સિટીમાં જમા કરવાનો નથી. યુનીવર્સિટીમાં સબમિટ કરાવવાનો ફાઈનલ રીપોર્ટ કાઢવા માટે પહેલા તમારે Exam Lock કરવી પડશે.


Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-4. Click on 'Lock Internal Exams'. After verification of the entry of the internal marks by the college, final submission should be done. By clicking LOCK. Marks cannot be changed once it is locked. Before LOCK, tick against all the check boxes.

Home Exam Student Internal Repeater Teacher Information Assignment

Export Student Details

SHASTRI SHASTRI SEM-I 2016-2017 CHANGE SEMESTER / YEAR

STEP 1 → STEP 2 → STEP 3 → **STEP 4** → STEP 5

Internal Marks Entry Internal Download Data Internal Testing Report **Lock Internal Exam** Final Internal Report

Exam Lock List

SHASTRI SHASTRI SEM-I Internal		TOTAL
Total Enrolled Student		5
Assigned Students in Exam		3
Total Repeater Students		4
Total Repeater Assigned Students in Exam		0
Total Students		9
Total Assigned Students in Exam		3

અહીં ચેકબોક્સ સમગ્રની સુચના વાંચી click કરી ટીક કરવી બાદ નીચે Lock વાળા button ઉપર click કરવાથી final entry submit થઈ જશે.

અમારી ડોલેજે SHASTRI SHASTRI SEM-I Internal ના બધા વિદ્યાર્થીના માર્ક્સ ચેક કરેલ છે. જેમાં કોઈ ભૂલ જણાતી નથી જે થોડું આ Exam લોક કરવા માગું છું.

Download Testing Student Data

Lock SHASTRI SHASTRI SEM-I Internal

Step -5 (Final Internal Report). By clicking on Final Internal Report, you can download the final report. This report is to be printed in two copies. One is to submit to the University after the stamp and sign of the principal.

Home Exam Student Internal Repeater Teacher Information Assignment

Export Student Details

SHASTRI SHASTRI SEM-I 2016-2017 CHANGE SEMESTER / YEAR

STEP 1 → STEP 2 → STEP 3 → STEP 4 → **STEP 5**

Internal Marks Entry Internal Download Data Internal Testing Report Lock Internal Exam **Final Internal Report**

Internal Marks Final Report

Download Final Report

Surekha
Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

IMPORTANT INSTRUCTIONS

1. The college/mahavidyalaya will have enter the data of internal exams in December for the semester 1,3,5 for Shastri and semester 1 for Acharya. The entry for semester 2,4,6, for Shastri and semester 2 for Acharya can be done in April. This can be done online only on www.sssu.in.
2. It is compulsory to submit the internal marks in hard copy within the given period.
3. All the records of the internal marks of the students are to be preserved and submit to the University whenever it is asked.
4. The marks of the repeater students are to be sent on the letter head of the college with the stamp and sign of the principal, and not online. But the college will have to submit to the University the internal marks of that student who appears as the first time and for full exams. Otherwise the result will show the absent of that student.
5. In case of any difficulty, you are requested to contact the Examination Department on 02876-244532 from 10.30 am to 6.00 pm on working days.



Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

Shree Somnath Sanskrit University



USER MANUAL


TO DOWNLOAD THE SEAT NUMBER AND HALL TICKET

Signature


Registrar,
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

The seat numbers of the students can be downloaded by the college/Mahavidyalaya after logging in by using the username and password. The procedure is as follows.

- 1) Open the browser, go to sssu.in, the following window will open. Enter password and username to log in as you do in case of enrollment process.




- Once you log in, the following window will open. Current year (2017-2018) will be by default in the drop menu of the year. Select EXAMS from ENROLLMENT and EXAM. To download the seat numbers. Click on the figure indicating program and old/new syllabus.




Erudh Meera

Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

- After the above said step, select Exam and select Level. The following window will open. For the entry of first semester of Shastri and Acharya, click on 'Enrollment to semester 1', for the data entry of semester 3, click on 'semester 2 to 3', for the data entry of semester 5 of Shastri, click on 'semester 4 to 5'.



- After clicking the semester number, the following window will open. You can download the numbers by clicking on DOWNLOAD THE REPORT as step 9.




Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)

- Step-9 Click on the download the report. Following window will open. You can download the reports of the regular and repeaters by selecting the buttons showed by the arrows.

Download Exam Candidate List

Download Regular Exam Candidate List External Caner Wise વિષયની વિગત સાથેનો સીટનંબર રેપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં Click કરશે. (Regular)

Download Regular Exam Candidate List →

Download Repeater Exam Candidate List →

Download Repeater Exam Candidate List Center Wise વિષયની વિગત સાથેનો સીટનંબર રેપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં Click કરશે. (Repeater)

Download Data in Excel

Download Regular Data in Excel

Download Repeater Data in Excel

Download Center Wise Seat Number Report

Download center wise Seat Number Report Regular ફોટો/સહિની વિગત સાથેનો સીટનંબર રેપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં Click કરશે. (Regular)

Download center wise Seat Number Report Repeater ફોટો/સહિની વિગત સાથેનો સીટનંબર રેપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં Click કરશે. (Repeater)

- The hall tickets for all the semesters can be downloaded by the college from the website after log in by the username and the password. The steps are as follows.
- Follow the steps number 1 to 3 as above. Select student menu, and select Download the Hall Ticket from the dropdown menu.

[Home](#) [Exam](#) [Student](#) [Internal](#) [Repeater](#) [Teacher Information](#) [Assignment](#)

[Set Student Roll Number](#)
[Export Student Det](#) [Assign Migration](#)
[Student ICard](#)
[Student detail Change](#)
[Download Hall Ticket](#)

SHASTRI SHASTRI SF


SEMESTER / YEAR

STEP 0 → **STEP 1** → **STEP 2** → **STEP 3** → **STEP 4** → **STEP 5** → **STEP 6** → **STEP 7** → **STEP 8** → **STEP 9**

Add Group Direct Entry UG SHASTRI SEM 1 Assign Exam Exam Detail Approved Student Report Reject Student Report New Student Repeater Lock Information Download Report


 Registrar
Shree somnath Sanskrit University
 Veraval, Dist. Gir Somnath (Gujarat)

- When you click 'Download the Hall Ticket', the window will open as below. You can download the hall tickets of the regular and repeater students by selecting the respective pdf file.



IMPORTANT INSTRUCTIONS

1. The confidentiality of the username and password is to be maintained by the principal. The principal has to see that the username and passwords are not misused. If required, change them frequently.
2. The principal will have take care that the information of the students like his photo and sign cannot be misused as they are available on seat number, hall ticket reports.
3. The hall tickets are to be issued to the students after the stamp and sign of the principal.
4. In case of any difficulty in downloading the hall ticket and seat numbers, you are requested to contact the examination department on 02876-244532 from 10.30 am to 6.00 pm on working days.

Surekha
Registrar
Shree somnath Sanskrit University
Veraval, Dist. Gir Somnath (Gujarat)